

# Meeting of BRICS Ministers of Foreign Affairs/International Relations

May 19, 2022

## BRICS વિદેશ બાબતો/આંતરરાષ્ટ્રીય સંબંધોના મંત્રીઓની બેઠક

મે 19, 2022

વિદેશ મંત્રી, ડૉ. એસ. જયશંકરે 19 મે, 2022 ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા BRICS વિદેશ બાબતો/આંતરરાષ્ટ્રીય સંબંધોના મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકની અધ્યક્ષતા પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના વિદેશ મંત્રી શ્રી વાંગે BRICS ની વારા મુજબ મળતા પ્રમુખપદ હેઠળ કરી હતી. ચી. બ્રાઝિલના સંઘીય પ્રજાસત્તાકના વિદેશ પ્રધાન, એમ્બેસેડર કાર્લોસ આલ્બર્ટો ફ્રાન્કો ફ્રાન્કો, રશિયન ફેડરેશનના વિદેશી બાબતોના પ્રધાન, એમ્બેસેડર સેર્ગેઈ લવરોવ અને દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર મંત્રી, સુશ્રી ગ્રેસ નાલેડી મંડીસા પાંડોરે, પોતપોતાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

મંત્રીઓએ, આદાન-પ્રદાનના ત્રણ સ્તંભો, રાજકીય અને સુરક્ષા, આર્થિક અને નાણાકીય અને લોકો-થી-લોકો અને સાંસ્કૃતિક વિનિમય પર આંતર- BRICS સહયોગને આગળ વધારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ સંદર્ભમાં, તેઓએ BRICS જોડાણને માર્ગદર્શન આપવા કામગીરી અંગેના 2021 નિયમો બદલ્યા હતા.

તેઓએ પુનરોચ્ચાર કર્યો કે બ્રિક્સ દેશો કોવિડ-19 રોગચાળાના ફેલાવા અને અસરોને નિયંત્રિત કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે અને WHO એ રોગચાળા સામે લડવામાં અગ્રિમ ભૂમિકાને; TRIPS માફી દરખાસ્ત સહિત WTO માં ચાલી રહેલી ચર્ચાઓનું મહત્વને સમર્થન આપેલ; અને 2030 ટકાઉ વિકાસ એજન્ડાના અમલીકરણ માટે હાકલ કરી હતી.

મંત્રીઓએ યુક્રેનની પરિસ્થિતિ પર ચર્ચા કરી અને રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતને સમર્થન આપ્યું. તેઓએ આ સંઘર્ષમાં ઉર્જા અને ખાદ્ય સુરક્ષાની અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

મંત્રીઓએ સુધારાની પ્રક્રિયાને આગળ વધારવા અને UN અને તેની સુરક્ષા પરિષદ સહિત, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને બહુપક્ષીય મંચોમાં, વિકાસશીલ દેશોના વધુ પ્રતિનિધિત્વના આલ્વાનને સમર્થન આપ્યું હતું જેથી તેઓ વૈશ્વિક શાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.

મંત્રીઓએ પુનરોચ્ચાર કર્યો કે UNFCCC અને તેના પેરિસ કરારના ઉદ્દેશ્યો, સિદ્ધાંતો અને જોગવાઈઓનું સન્માન કરવું જોઈએ. તેઓએ આબોહવા પરિવર્તનનો સામનો કરવા વિકાસશીલ દેશોને મદદ કરવા ટેકનોલોજી અને આબોહવા ધિરાણ પૂરું પાડવા માટે વિકસિત દેશો દ્વારા તેમની પ્રતિબદ્ધતાઓની પરિપૂર્ણતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

મંત્રીઓએ જ્યારે પણ, જ્યાં પણ અને કોઈના પણ દ્વારા થતાં આતંકવાદની સખત નિંદા કરી હતી અને આતંકવાદીઓની સરહદ પારની હિલચાલ સહિત તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

મંત્રીઓએ વૈશ્વિક શાસન પર BRICS અને વિકાસશીલ દેશો વચ્ચેના સંવાદમાં ભાગ લીધો હતો અને BRICS પ્રક્રિયા સાથે વધુ જોડાણ અંગે ચર્ચા કરી હતી.

મંત્રીઓએ B2B અને P2P બંને ફોર્મેટમાં વિકાસ અને બેઠકોનું સ્વાગત કર્યું હતું અને આ ક્ષેત્રોમાં વધુ સહકારની આશા વ્યક્ત કરી હતી.

નવી દિલ્હી

મે 19, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.